Reg. office: 1201, 1202, 1203- GIDC
Halol- 389350. Panchmahal,
Gujarat, INDIA
Phone: 02676 -220621

Date: 5th September 2022

To,
The Manager,
National Stock Exchange of India Limited
Exchange Plaza,
Bandra Kurla Complex
Bandra (East),
Mumbai - 400 051.

Dear Sir/Madam,

Sub: Disclosure under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

NSE Emerge Scrip Symbol: INNOVATIVE

Pursuant to Regulation 30, read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we hereby enclose copy of advertisement published in the Loksatta (Gujarati) and Business Standard (English) on dated September 05, 2022 confirming completion of dispatch of 27<sup>th</sup> AGM Notice and Annual Report for the financial year 2021-2022.

Kindly take the same on record.

Thanking you, FOR INNOVATIVE TYRES & TUBES LIMITED

Arvind Digitally signed by Arvind Ramkishore Tambi

ARVIND TAMBI
CFO & COMPANY SECRETARY

Encl: as above

હાલના રાજકીય માહોલ ઉપરથી આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં

# દાહોદ જિલ્લાની તમામ બેઠકો પર અણધાર્યા પરિણામો આવવાની શક્યતા: નેતાઓમાં રઘવાટ

ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે ભાજપા, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અન્ય પ્રાદેશિક પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપા અને આમ આદમી પાર્ટી પોતાની તરફી જુવાળ ઉભો કરવામાં નિત નવા પેતરા રચી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા મરણીયા પ્રયાસ કરી રહી છે. ભાજપા આ વખતે ટિકિટની ફાળવણીના મામલે કાચું ન કપાઈ જાય તે માટે વધુ સજાગ બની છે. હાલ તો ભાજપે રાજ્યમાં એક વખત આખે આખું મંત્રીમંડળ બદલી નવા ને કારભાર સોપ્યો પરંતુ તેમાં નવાઓએ પણ કાંઈ કાઠું કાઢ્યું હોય તેમ લાગતું નથી. જેથી જુનાઓને ફરીવાર યાદ કરવામાં આવી

કરશે તેવું લાગી રહ્યું છે. તેમ છતાં અપવાદરૂપ કેટલીક બેઠકો પર આનો રીપીટ થિયરીના અમલમાં થોડી ઘણી બાંધછોડ કરશે તેવું પણ લાગી રહ્યું છે.

આદમી પાર્ટીને આ ચૂંટણીમાં કાંઈ ગુમાવવાનું નથી. પરંતુ જેટલો વધુ ફાયદો મળે તે લઈ લેવા પ્રયત્નશીલ છે. જ્યારે કોંગ્રેસ પોતાના અસ્તિત્વની રહી સહી આશાઓને જીવંત રાખવા મથામણ કરતી જોવા મળી રહી છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લાની છ વિધાનસભાની બેઠકો પૈકી ત્રણ કોંગ્રેસ પાસે છે અને ત્રણ ભાજપ પાસે છે. આ વખતે ઝાલોદની બેઠક ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે કોંગ્રેસે ગુમાવવાનો વારો આવે તેમ કહેવું અસ્થાને નથી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર ભાજપ અને કોંગ્રેસ રહ્યા છે. હાલ તો ભાજપા આગામી તમામ ચૂંટણીઓમાં સામસામા ટકરાતા ડિસેમ્બરમાં યોજનારી વિધાનસભાની હતા .જ્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીની ટિકિટોની ફાળવણીમાં ચૂંટણીમાં પવનવેગે ગુજરાતમાં પગ

ગુજરાતમાં સત્તાની વેતરણી પાર કરવા મરણિયા પ્રયાસ કરી રહી છે. અને હાલના રાજકીય માહોલ પરથી આમ અત્યારથી જ આદરી દીધા છે. હાલ આદમી પાર્ટી અને ભાજપની સીધી ટક્કર રહેશે તેવું લાગી રહ્યું છે. કારણકે મોંઘવારી અને બેરોજગારીથી ત્રાસી ગયેલી જનતા હવે પરિવર્તન ઝંખે છે.

તેવોજ માહોલ ઊભો કરવામાં આ તબક્કે આમ આદમી પાર્ટી મહદંશે સફળ થતી હોય તેવું લાગી રહ્યું છે. દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કાંઈ જ કામ કર્યા નથી તેવું લોક મૂખે કહેવાય રહ્યું છે. . ભાજપા કે કોંગ્રેસના હાલના ધારાસભ્યોનાં પ્રજાના વિકાસના પોતે કરેલા કામોના લેખાજોખા કરવાની જરૂર નથી. કારણ કે પોતાને તો ખબર જ છે કે પોતે કેટલા કામ કર્યા છે. તેના પરથી પ્રજા પોતાને કેટલો સહયોગ આપશે તે તો અત્યારથી જ તેઓ જાણી ગયા છે. જેથી કેટલાય ધારાસભ્યોએ

દીધી છે અને તેવાઓએ પોતાના સંતાન કે પત્નીને ટિકિટ મળે તેવા પ્રયાસો હજી વિધાનસભાની ચૂંટણીને ત્રણ માસથી વધુ સમય બાર્કી છે. ત્યારે નવરાત્રિમાં શુભ મુહૂર્તે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

તેવા સમર્યે હાલ ભાજપા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પ્રજાને મોટી મોટી મફતની જાહેરાતોની લોલીપોપ આપી પ્રજાનો વિશ્વાસ જીતવાના મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે પ્રજા હવે કોના પર વિશ્વાસ કરશે તે કહેવું અત્યારે અઘરું છે કારણ કે મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને નવા વિકલ્પની શોધમાં છે. ત્યારે કોના પ્રલોભનો કેટલા કામયાબ નીવડશે તે તો ચૂંટણીના પરિણામ પછી જ

### રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનેઃ સ્થાપન સંયુકત મોરચા દ્વારા રેલી

લુણાવાડા,તા.૪

રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુકત મોરચો મહીસાગર દ્વારા રેલી યોજવામાં આવી.જે લુણાવાડાના મુખ્ય માર્ગ પર થઈ કલેકટર કચેરીમાં અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા,સાતમા પગાર પંચના લાભો આપવા, ગ્રેડ પે સહિતનાં પશ્રો બાબતે તાત્કાલિક નિકાલ લાવવા માંગ કરી હતી. મહીસાગર જિલ્લા રાષ્ટ્રીય સંયુકત મોરચાના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ તથા માધ્યમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી વી.કે. સંગાડા, સંગઠન મંત્રી પ્રદીપ પટેલ, લક્ષ્મણભાઈ પટેલિયા, પ્રભાતસિંહ પરમાર, નવનીતભાઈ પંચાલ સહિતની આગેવાનીમાં રેલીનું સફળ આયોજન થયું હતું.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત સંયુક્ત મોરચાની મહીસાગર જિલ્લાની મહારેલીમાં ૧૫૦૦ જેટલાં શિક્ષકો,કર્મચારીઓ જોડાઈ રેલીને સફળ બનાવી હતી.

## રામસાગર તળાવમાં વિસર્જનની તૈયારી અને વ્યવસ્થા ગોધરા ખાતે ગણેશ વિસર્જનની શોભાયાત્રા નિર્વિધ્ને પાર પડે તે માટે વહીવટીતંત્ર સજ્જ

પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર એ આવતીકાલે ગોધરા ખાતે નીકળનારી ગણેશ વિસર્જનની શોભાયાત્રાનું સૂક્ષ્મ આયોજન કર્યું છે, જે મુજબ વિસર્જનની શોભાયાત્રા નિર્વિધ્ને પાર પડે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેમજ મુશ્કેલીનો ઝડપથી હલ થાય તે માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠકો યોજી મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરી હતી. સાથે પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય એ પણ રામસાગર તળાવ કીનારે તૈયારીઓ ની સમિક્ષા કરી હતી તો બીજીબાજુ પોલીસે વિસર્જન પુર્વે ફલેગ માર્ચ યોજી હતી.બેઠકમાં તેમણે નગરપાલિકાના અને મધ્ય ગુજરાત વીજકંપનીઓના અધિકારી કર્મચારીઓને રસ્તાના ખાડા, યોગ્ય રીતે દુરસ્ત કરવા, લટકતા વીજ વાયરો અને વરસાદની પરિસ્થિતિમાં કોઈ



પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે શોભાયાત્રા દરમિયાન પૂરતા માટે લેવાનારા સાવચેતીના પગલા અંગે જરૂરી સૂચનો સાથે સૂચના આપી હતી. આ ઉપરાંત, શહેરના રામસાગર તળાવમાં વિસર્જનની તૈયારીઓ, વ્યવસ્થાઓ અંગે પણ સુચનો કર્યા હતા. ગોધરા શહેરના દિને શોભાયાત્રાના નિશ્ચિત પોઈટ વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી ૩.૨૫ કિલોમીટરનો રૂટ ધરાવતી આ શોભાયાત્રાના દરેક પાસાઓની ઝીણવટપૂર્વકની ચર્ચા યોજી હતી. જિલ્લા પોલિસે

પોલિસ બંદોબસ્તા સાથે કાયદો અને સલામતી બાબતે ચર્ચા કરી હતી. તેમણે શોભાયાત્રા દરમિયાન થનારી વિડીયોગ્રાફીની વિગતો પણ આપી હતી. ગણેશ વિસર્જનના પર તબીબી ટીમની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૭૦ તરવૈયાઓ અને ૪ જેટલી ક્રેન તહેનાત કરવામાં આવી છે.

# સેઘવા સિમરીથી વાઘવા સુઘીનો સાંકડો રસ્તો પોહળો કરવા લોક માંગ



બોડેલી,તા.૪

બોડેલી તાલુકાના સેઘવા સિમરીથી વાઘવા સુઘીનો સાંકડો રસ્તો પોહળો કરવા ઉગ્ર લોક માંગ થઈ રહી છે.સે.સિમરી થી વાધવા વચ્ચે અવાર નવાર થતા અકસ્માતો જોવા મળી રહ્યા છે બોડેલી જાંબુઘોડા થી જેતપુર પાવીને વિસ્તાર માં થી જેતપુર પાવી જતા જોડતો મુખ્ય માર્ગ સેગવા સીમડી થી વાગવા સુધીનો ત્રણ કિમી નો માર્ગ અત્યંત સાંકડો હોય આ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે જેને લઇ વાઘવા તેમજ આસપાસના ઉપરથી ૨૪ કલાક વાહન ચાલકો આઠથી દસ ગામોના રહીશો ને અવર-જવર કરે છે જેથી આ માર્ગને આ રોડ ઉપરથી અવર-જવર તાકીદે પહોળો કરવામાં આવે તેવી કરતા અનેકવાર અકસ્માત સર્જાય લોકમાંગ ઉદભવી છે જેથી લાગતા છે જેમાં કેટલાક જીવ ગુમાવ્યો હોસ્પિટલમાં રહેવાનો વારો આવ્યો નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી જેતપુર પાવી જવાના અનેક માર્ગો રહ્યા છે

છે પરંતુ બીજા માર્ક કરતાં આ માર્ગ નું ડિસ્ટન્સ અડધું છે માત્ર ૧૬ કિલોમીટરના અંતરમાં આ માર્ગે જેતપુર પાવી પહોંચી જવાય છે અન્ય કોઈપણ માર્ગ પરથી જેતપુરપાવી જાવ તો ૩૦ ાદ્વ જેટલું અંતર કાપવાનો વારો આવે છે જાંબુઘોડા અને મધ્યપ્રદેશ છોટાઉદેપુર વગેરે વિસ્તારમાંથી પાવાગઢ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે પણ આ રૂટ આશીર્વાદરૂપ છે અને આ માર્ગ વળગતા આ અંગે પોતાનું ધ્યાન

# ઠગ ટોળકીઓ સક્રિય બની આદિવાસી ખેડૂતોને છેતરે છે નસવાડી તાલુકાના કંકુવાસણ ગામે બોગસ ખાતર વેચતા બે પરપ્રાંતિયોને ખેડૂતોએ ઝડપી પાડ્યાં

નસવાડી,તા.૪

નસવાડી તાલુકાના કંકુવાસણ ગામે બોગસ ખાતર વેચતા બે પરપ્રાંતિયોને ખેડૂતોએ ઝડપી પાડ્યા હતા. આ ખાતર વેચનાર ઇસમો બે દિવસ પહેલા ગામમાં ખાતર વેચી ગયા હતા તેમાં નાના નાના પથ્થર તેમજ ઝીણી રેતીથી ખાતર બનાવેલું હતું આ બોગસ ટોળકીને પોલીસે પકડી નસવાડી પોલીસ સ્ટેશન લાવી અને તપાસ હાથ ધરી હતી.

નસવાડી તાલુકામાં કંકુવાસણ ગામે ડી.એ.પી ખાતર વેંચાનાર મધ્યપ્રદેશના બે ઇસમો બોડેલી ખાતે ઓફિસ બનાવી નસવાડી તાલુકાના કંકુ વાસણ ગામે એક થેલી ખાતર ના **૬૦૦ થી ૮૫૦ રૂપિયા સુધીની નો** ભાવ લઇ પહેલા ઓડર લઇ જતા હતા અને બીજા દિવસે ખાતરની ડીલેવરી આપતા હતા ખેડૂતોને ઓછા ભાવે તેમજ ઘર આંગણે ખાતર મળતું હોવાથી ખાતર ખરીદી છે તો કેટલાકને મહિનાઓ સુધી કેન્દ્રિત કરી વિસ્તારની સમસ્યાનું કરી હતું પરંતુ ખેતરમાં ખાતર નાખતા ખાતર ઓગળતું જ ન હતું છે જાંબુઘોડા થી પાવીજેતપુર ને છે બોડેલી તાલુકાના સેઘવા સિમરી જેનાથી ખેડૂતોને છેતરાયા હોવાનો કડક સજા કરાવે તે જરૂરી બન્યું છે જોડતા આ માર્ગ ઉપર સેંકડો ગામો થી વાઘવા સુધી અત્યંત સાંકડો અહેસાસ થયો હતો જ્યારે બીજા થોડા દિવસ પહેલા કિસોન સભોના

હિત રક્ષક સમિતિના સભ્યો સાથે તે સમજાવવામાં આવ્યું હતુ. ધરણાં લડતમાં,પોતાના હક ની માંગણી

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દાહોદના નેજા હેઠળ જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપન માટે ધરણાં

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દાહોદ જિલ્લામાં ત્રણ હજાર જેટલાં સ્થળથી દ્વન ના સુરની સાર્થે જી ની માટે ત્રણ હજાર જેટલાં કર્મચારી

આયોજિત જૂની પેન્શન યોજના કર્મચારી ભાઈ-બહેનો જોડાયા હતા. માંગણીના બુલંદ સુર સાથે અંદાજિત ભાઈ - બહેનો જોડાઈને,મહારેલીમાં

પુનઃ સ્થાપન ત<sup>ે</sup>થા બીજા કેટલાક વણ ધરણાં કાર્યક્રમ નાં સ્થળે<sup>\*</sup>જી મેળવવા ત્રણ કિલોમીટર**ૅસુધી પગપાળા સૂત્રોચ્ચાર દ્વારા શિક્ષકોની** માંગના

ને શનિવારના રોજ દાહોદ જિલ્લા મિત્રોને દ્રઁજી જે નવી પેન્શન યોજના જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપન સુધી પહોંચાડવા અને સહભાગી

મુકામે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના છે તેની સાથે- સાથે ઘડપણમાં સહારા થાય તે માટે સૂત્રોચ્ચાર કરતા બની સફળતાં અપાવવા બદલ

મેંદાનમાં યોજાયેલા ધરણાં કાર્યક્રમમાં માટે ફક્ત ને ફક્ત જી જ જરૂરી છે,તે કરતા કલેકટર કેચેરીએ પહોંચી સૌ શિક્ષક ભાઈ બહેનોનો રાષ્ટ્રીય



આ ઠગ ટોળકીને પકડી પાડવા માટે પિંડી થઈ રહી છે રાહ જોઈને બેઠા હતા જયારે ખાતર વેચવા માટે આ ટોળકી આવતા તેને ગ્રામજનો એ ઝડપી પાડી હતી અને પોલીસ ને બોલાવવા માં આવી હતી જયારે આ ઠગ ટોળકી ના ૨ સભ્યો ને પકડી ને પોલીસ સ્ટેશન લાવી છે આદિવાસી વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી આવી ઠગ ટોળકીઓ સક્રિય બની છે અને ગરીબ આદિવાસી ખેડૂતો ને છેતરે છે પોલીસ આવી ટોળકીઓ ને પકડી ને

જણાવ્યા મુજબ ૮૦૦ રૂપિયામાં સુથારે જણાવ્યું હતું. ખાતરની એક થેલી લીધી હતી

પ્રમાણે રોજેરોજ અવરજવર કરતા .સિમરી થી વાધવા વચ્ચે અવાર જોતા નાના નાના પથ્થરો થી ખાતર બાદ ખેડૂતોને પચ્ચાસ ટકા સયાહ માં કરીયે છીએ ખાતર વેચવાનું કોઈપણ જીવ બચાવે છે, તેમ કહ્યું હતું. હોય છે કારણ કે જાંબુઘોડા થી નવાર થતા અકસ્માતો જોવા મળી બનેલું હતું અને તેના ઉપર કલર બોર કરી આપવાની લાલચ આપી જાતનું લાઇસન્સ નથી ખાતર અમે

# છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે:મંત્રી નિમિષાબેન સુથાર



છોટાઉદેપુર,તા.૪

છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું મેડિકલ કોલેજ માટેનું સ્વપ્ન આગામી સમયમાં સાર્થક થશે એમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર ભીલ ગિરીશ ભાઈ ખેડૂતોના જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન

છોટાઉદેપુર ખાતે આવેલી અને ઘર બેઠા ખાતર આપતા અમે નર્સિંગ કોલેજ ખાતે સ્ટાફ નર્સીસના લલચાયા હતા બજાર માં ખાતર સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિતોને ૧૩૦૦ થેલી મળે છે સસ્તા ખાતરમાં સંબોધતા મંત્રી નિમિષાબેન સુથારે નાના નાના કાંકરા નીકળ્યા અને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ખેતર માં ખાતર નાખ્યું તો ખાતર રસીકરણ થકી આમજનતાને સુરક્ષા કવચ પુરૂં પાડવામાં નર્સ બહેનોનો સતીષ ભાઈ ચૌહાણ ખાતર સૌથી મોટો ફાળો રહેલો છે. સ્ટાફ વેચનાર એજન્ટ ના જણાવ્યા મુજબ નર્સ આરોગ્ય વિભાગની કરોડરજજૂ ખાતર મધ્ય પ્રદેશથી આવે છે અને છે. નર્સ દર્દીને પોતાના પરિજનની બોડેલી ઉતરે છે ૧૬૦૦૦ હજાર જેમ સેવા ચાકરી કરતી હોય છે અને ના વાહન ચાલકો અહીથી નિત્યક્રમ હોઇ પોહળો કરવા ઉગ્ર લોક મોગ ખેડૂતોએ ખાતરને થેલી ખોલી એદર કાર્ડ બનાવીને ખેડૂતો ને છતયો ત્યાર રૂપિયા મો કંપનીમાં મોહને નોકરી ફરજના ભાગરૂપે અનેક લોકોના

સિવિલ હોસ્પિટલના સ્ટાફ ચડાવ્યો હતો જેને લઇને ખેડૂતોએ છેતર્યા અને હવે ખાતર માં છેતર વેચ્યું હતું તેમાં પથ્થર નીકળ્યા છે અંગે વાત કરતા જણાવ્યું હતું કે,

### પશ્ચિમ રેલવે–વડોદરા

ફિક્સ્ડ બલ્ક હેડ થી ફોલ્ડેબલ બલ્ક હેડમાં રૂપાંતરણનું કાર્ય નારતના રાષ્ટ્રપતિ માટે અને વતી ચીફ વર્કશોપ મેનેજર પતાપનગર દ્વારા નીચે આપેલ વિગત મુજબ ઈ–ટેન્ડ બામંત્રિત કરે છે. **ઈ-ટેન્ડર નોટીસ નં. M337**\_ PRTN 22-23 Bulkhead (1) รเนา ู่ -แน BRN / BRNA / BRNAHS / BRN 22.9 ગનોમાં ફિક્સ્ડ બલ્ક હેડ થી ફોલ્ડેબલ બલ્ક હેડમ રૂપાંતરણનું કાર્ય. **(2) સૂચિત માત્રાઃ** 75 વેગન **(**3) કામની અંદાજીત કિંમતઃ ₹ 88.27.930.12 (રૂપિયા ઈક્ર્યાંસી લાખ સત્યાવીસ હજાર નવસો ત્રીર ત્રને બાર પૈસા પૂરા) **(4) જમા કરાવવાની બી સિક્યુરીટીઃ** ₹ 1,76,600/- (રૂપિયા એક લાપ શેંત્તેર હજાર છસો પૂરા) **(5) કાર્ય પૂર્ણ કરવાનો મમયગાળોઃ** 18 મહિના (અઢાર મહિના) **(**6) ઓફરની માન્યતાઃ 90 દિવસ (7) ટેન્ડર જમ કરવાની અને ખુલવાની તારીખ અને સમયઃ તા.30 09-2022 ના 15:00 કલાકે બિડીંગ બંધ કરવામ નાવશે અને એજ તારીખે 15:30 કલાકે ટેન્ડર ખોલાશે (8) વેબસાઈટ વિગત અને સ્થળ જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ શકાશેઃ વેબસાઈટઃ www.ireps.gov.in ચીક વર્કશોપ મેનેજરની ઓકીસ. પ્રતાપનગર. પશ્ચિ રેલવે-390004



હેલ્થ પ્રેકટિશનરનો મુખ્ય ધ્યેય દી,

માતા અને બાળક જીવ બચાવવાનો

છે. દરેક નવું જન્માનાર બાળક સૌથી

પહેલા નર્સનું મોંઢું જુએ છે, પોતે એક

મહિલા તરીકે આરોગ્ય મંત્રી બન્યા

એનો હર્ષ અને ગૌરવની લાગણી

અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

### **Axel Polymers Limited**

CIN: L25200GJ1992PLC017678 Regd. Office: 309, Moxi, Sankarda-Savli Road, Tal. Savl

NOTICE is hereby given that 30th Annual General Meeting ('AGM') of the Shareholders of Axe Notice of the 30th AGM. The Company has sent the Annual report along with Notice convening accordance with the Circular issued by the Ministry of Corporate Affairs (MCA) dated 5th May 2022 read with circulars dated 14th December, 2021, 13th January, 2021, 5th May, 2020, 13th April, 2020 and 8th April, 2020 and the Securities and Exchange Board of India (SEBI) Circulars dated 13th May, 2022, 15th January, 2021 and 12th May, 2020. The Annual Report along with the 30th AGM Notice is also available on the website of the Company at www.axelpolymers.com BSE Limited at www.bseindia.com and on the website of the National Securities Depositor

Limited ('NSDL') at www.evoting.nsdl.com.

Cut-off Date / Record Date Thursday, 22<sup>nd</sup> September, 2022 From Friday, 23rd September, 2022 to Thursday, 29th September, 2022 (both days inclusive) for the purpose of 30th AGM

Remote E-Voting Facility by Remote F-Voting

of the Company National Securities Depository Limited ('NSDL') From Monday, 26th September, 2022 at 9:00 A.M. (IST) to The remote e-voting shall be disabled by NSDL after

05:00 p.m. (IST) on Wednesday, 28th September, 2022.

Any person, who acquires shares of the Company and becomes member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain login ID and password by sending a request to evoting@nsdl.co.in.

Shareholders may note that the facility for voting will also be made available during the 30th AGM. and those shareholders present in the 30th AGM through VC/OAVM, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the 30th AGM. The Shareholders members who have cast their votes by remote e-voting prior to the 30th AGM may also attend the 30th AGM but shall not be entitled to cast their votes again; and only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the 30th AGM. The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical ode and for shareholders who have not registered their email addresses is provided in the Notice

Member who requires assistance for e-voting before or during AGM, can contact Ms. Pallav Mhatre, Senior Manager on no.: 1800 1020 990 and 1800 22 44 30 or sent a request at

For Axel Polymers Limited

Date: 3rd September, 2022

evoting@nsdl.co.in

મકરપુરા, વડોદરા-૩૯૦ ૦૧૦, ગુજરાત, ભારત.

Jigardan Gadhav

BUNDY

# બોડેલી અલીપુરાની ગજાનંદ છોટાઉદેપુરવૃંદાવનસોસાયટીની પાછળના પાર્કના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર ભાગેથી ૯ફ્ટલાંબો અજગર ઝડપાયો

ઉંકેલ્યા પ્રશ્નો માટે તા.૩/૯/૨૦૨૨ માટેની લડત માં સહભાગી થનાર સૌ

પ્રાથમિક સંવર્ગ,માધ્યમિક સંવર્ગ, માટે સંગઠનના વિવિધ હોદ્દેદારો દ્વારા

ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ,આરોગ્ય જુદા-જુદા ઉદાહરણો દ્વારા જૂની પેન્શન

કર્મચારી મંડળ, મજદૂર સંઘ,ઁજી યોજના કેટલી મહત્વની અને જરૂરી છે



બોડેલી,તા.૪

જેવા અનેક કાર્યક્રમો પરંપરાગત વર્ષો બોડેલી ના અલીપુરા વિસ્તારમાં થી કરવમાં આવે છે તે મુજબ હાલ હાલોલ રોડ ઉપર આવેલ ગજાનંદ પણ તેણે અનુસરવા માં આવે છે પાર્ક ખાતે ગણેશ ચતુર્થી ના દિવસે જયારે પોલીસ મથકે ઉજવાતા ગણેશ દુંદાળાદેવ ની ગજાનંદ નવ યુવક ઉત્સવમાં સાર્વજનીક ગણેશોત્સવ ના મંડળ દ્વારા ડીજે ના તાલે વાજતે સભ્યો દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવા ગાજતે સાસ્ત્રોક વિધિ કરી પૂજા માં આવતો હતો પરંતું પોલીસ અર્ચના કરી સ્થાપના કરવામાં આવી મથકનવુ બનતા અને રાત્રે ગણેશ હતી અને અહિ રોજ અવનવા પ્રોગ્રામ ઉત્સવ માં દર્શનાર્થીઓ નો ધસારો કરી બાળકો તેમજ વડીલો ભક્તો ને વધતા હલોલ રોડ ઉપર ગજાનંદ પાર્ક અનુરૂપ ભજન મંડળીઓ દ્વારા ભજન ખાતે ૧૨વર્ષ થી ઉજવણી કરવામાં કીર્તન તેમજ સંગીત પાર્ટી ડાન્સ સ્પર્ધા આવી રહી છે.

# ને સાર્થક કરતાં પોતાના હકની આભાર વ્યક્ત કર્યો હતો.

ચાલીને હજારો કર્મચારીઓ બુલંદ અવાજને ગાંધીનગર સરકાર

આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો દાહોદ નાં સંયોજક

સંયુક્ત મોરચો દાહોદના આહ્વાન શ્રી બળવંતસિંહ ડાંગરે ખૂબ ખૂબ



છોટાઉદેપુર,તા.૪

છોટાઉદેપુર નગરમાં આવેલ વૃંદાવન સોસાયટીની પાછળના ભાગમાંથી આજરોજ ૯ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ફફડાટ ફેલાયો હતો. અજગરે દેખા દેતા તેને મેહનત બાદ પકડી પાડવામાં આવ્યો મુક્યો હતો.

વૃંદાવન સોસાયટીના આસપાસના વિસ્તારમાં મરઘાં, બતક, સસલા, સહિતના પક્ષીઓને ગળી ગયો હોય જે આજરોજ ભારે મેહનત બાદ પકડવાની કામગીરી હાથ ધરવામાં હાથમાં આવતા જીવદયા પ્રેમીઓએ આવી હતી. અને રેસ્ક્ચુ કરી લાંબી તેનું રેસ્ક્ચુ કરી જંગલમાં છોડી Date: September 03,2022 Place: Vadodara

હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ અજગર

## INVOVAT **INNOVATIVE TYRES & TUBES LIMITED**

CIN: L25112GJ1995PLC086579

Registered Office: 1201, 1202, 1203 - GIDC Halol -389350, Panchmahals, Gujarat Tel.: (02676) 220621 Email: investors@innovativetyres.co.in; Website: www.innovativetyres.com

#### NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 27th Annual General Meeting (ARM) of the Members of Innovative Tyres & Tubes Limited will be held on Wednesday, September 28, 2022 at 10:00 A.M. (IST) through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("EEB) (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015, read with Ministry of Corporate Affairs ("MCA") General Circular No. 14/2020 dated April 08, 2020, and General Circular No. 02/2021 dated January 13, 2021 and other applicable circulars issued by the MCA and SEBI Circular dated May 12, 2020. Ceneral Circular No. 17/2020 dated January 13, 2021 and other applicable circulars issued by the MCA and SEBI Circular dated May 12, 2020. Ceneral Circular No. 17/2020 dated January 13, 2021 and other applicable circulars issued by the MCA and SEBI Circular dated May 12, 2020. Circular dated January 15, 2021 and Circular Mac Mary 13, 2022 (collectively referred to as "relevant circulars"), the Notice of the AGM and Annual Report including the Audited Financial Statements for the financial year 2021-22 have been sent in electronic mode to Members whose email Ibs registered with the Company or the Depository Participants.

The copy of the Annual Report and AGM notice is also available on the Company's Website at www.innovativetyres.com, websites of the stock exchange i. e. National Stock Exchange of India Limited-Emerge Platform at www.nseindia.com and website of Link Intime India Private Limited ("LIIPL") at https://www.linkintime.co.in. The dispatch of Notice of the AGM through e-mails has been completed on September 2, 2022

on September 2, 2022

E-VOTING

Members are provided with a facility to attend the AGM through electronic platform provided by Company's Registrar and Share Transfer Agent viz. LIIPL. Members are requested to visit https://instameel.linkintme.co.in and access the shareholders/members login by using the remote evolting credentials provided to them. The documents pertaining to the items of business to be transacted the AGM shall be available for inspection at www.innovativetyres.com

in the AGM shall be available for inspection at www.innovativetyres.com. Instructions for Remote e-Voting and e-voting:

1. Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time, and Regulation 44 of SEBI (Usting Obligation and Disclosure Requirements) Regulation, 2015 the Members are provided with the facility to cast their votes on all the resolutions as set out in the Notice of AGM using electronic voting system ("Remote e-Voting") provided by LIPL. Member's holding shares either in physical form or in dematerialized form, as on Wednesday, September 21, 2022 ("Cut-off date") can cast their vote through remote e-voting of LIIPL Le. https://instavote.linknime.co.in. A person whose name is recorded in the register of Members or in the Register of Beneficial Owner maintained by the Depositories as on the Cut-off date only shall be entitled to avail the facility of Remote e-Voting.

2. The Remote e-Voting period will commence on Sunday, September 25, 2022 at 9.00 A.M. (IST) and ends on Tuesday, September 27, 2022 at 5.00 P.M. (IST). The Remote e-Voting module shall be disabled by LIIPL thereafter. Once the vote on a resolution is cast by the member, the member cannot modify it subsequently.

3. Members who have acquired shares after the sending of the Annual Report through electronic means

10.0 Members who have acquired shares after the sending of the Annual Report through electronic means and before the Cut-off date may obtain the USER ID and password by sending a request at enotices@linkintme.co.in or investors@innovativetyres.co.in. However, if a person is already egistered with LIIPL for remote e-voting then he/she may use the existing USER ID and Password and

cast the vote.

4. Members attending the AGM through VC/OAVM but who have not casted their vote by Remote eVoting shall be eligible to cast their vote through e-Voting during the AGM (when window for e-voting is
activated upon instructions of the Chairman). Members who have voted through Remote e-Voting shall
be eligible to attend the AGM through VC/OAVM, however they shall not be eligible to vote at the meeting.
Further the Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of
reckoning the quorum under Section 103 of the Act.

5. The procedure of e-voting is provided in the Notice of the AGM as well as in the E-mail sent to the
members by LIIIPL. Please refer the e-voting user manual for members available in the downloads
section of the e-voting websites of LIIPL i.e. https://instavote.linkintime.co.in. In case the sharefoldors'
have any oureins or rissues regarding e-voting nules are feet the Froquently Asked Clusstins ("FAGOS")

have any queries or issues regarding e-voting, please refer the Frequently Asked Questions ("FAQs" and INSTAVOTE E-voting Manual available at https://instavote.linkintime.co.in under help section o write an e-mail to endices@inkintime.co.in or call at 1et; 022-4918 6000. Further, the Shareholders are also requested to refer to the Notice of the AGM for more details on process to be followed from their side, if any, in this regard.

BOOK CLOSURE

NOTICE is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act 2013 read with Companies (Management and Administration) Rules 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share September 28, 2022 (both days inclusive) for the purpose of AGN

For Innovative Tyres & Tubes Limited **Arvind Tambi** Company Secretary and Compliance Officer બંડી ઈન્ડિયા લિમિટેડ 6 CIN: U29199GJ1996PLC029520 **રજી. ઓફિસ** : નંબર ૨, જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,

#### **ร)** ต : ๐२ ร น - ร น 3 น 3 น ย - มิย์ ต : rakeshsharma@tifs.com જાહેર નોટીસ - વીસી / ઓએવીએમ દ્વારા કંપનીની ૫૧મી વાર્ષિક સાધારણ સભા

કંપની અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈઓ અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સાધારણ પરિપત્રો જે તારીખ : એપ્રિલ ૮, ૨૦૨૦, એપ્રિલ ૧૩, ૨૦૨૦, મે ૫, ૨૦૨૦, જાન્યુઆરી ૧૩, ૨૦૨૧, કિસેમ્બર ૮, ૨૦૨૧, કિસેમ્બર ૧૪, ૨૦૨૧ અને મે ૫, ૨૦૨૨ (જે એકત્રિત રીતે **'' એમસીએ પરિપત્રો''** તરીકે સંદર્ભિત થશે) ના અનુસાર બંડી ઈન્ડિયા લિમેટેડ (કંપની) ની પ૧મી વાર્ષિક સાધારણ સભા શુક્રવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે (ભારતીય સમય), વિકિયો કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓકિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા

જે કંપનીના સભ્યો ભોતિક રૂપમાં શેર્સ ધરાવે છે અથવા જેમને પોતાના ઈ-મેઈલ સરનામાની નોંઘણી કંપનીમાં કરાવેલી નથી, તેઓ પોતાનો મત (વોટ) ઈ-વોટીંગની સુવિધાઓ જે કંપનીએ પ્રદાન કરેલ છે, તેનાથી આપી શકશે. જેની વિગતવાર પ્રક્રિયા ૫૧મી સભાની નોટીસમાં વર્ણવેલ છે.

ડિમેટીરલાઈઝડ અથવા ભોતિક રૂપમાં શેર્સ ધરાવતા સભ્યોને વિનંતી છે કે તેઓ કંપનીનો સપંર્ક rakeshsharma@tifs.com પર કરી પોતાની નીચે મુજબની વિગતોની નોંઘણી કરે. (૧) ઈ-મેઈલ દ્વારા કંપનીના સભાની, વાર્ષિક અદેવાલ અને અન્ય દસ્તાવેજોની નોટિસ મેળવવા માટે ઈ-મેઈલ સરનામું અને (૨) સીધા બેંક ખાતામાં ભાવિ ડિવિડન્ડ મેળવવા માટે બેંક ખાતાની વિગતો.

બંકી ઈન્ડિયા લિમિટેડ રાકેશ શર્મા સંપુર્ણ સમય નિયામક (WTD)

અને કંપનીના સચિવ

ડિઆઈએન : ૦૦૧૨૫૦૨૨

તારીખ: ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સ્થળ : વકોદરા.





CHANDKHEDA BRANCH SHOP NO. 40-44. NAKSHTRA COMPLEX, IOC ROAD, CHANDKHEDA Ahmedabad - 380006. **PHONE**: 079 - 27630118/27630119

POSSESSION NOTICE [See Rule 8(1)]

(For immovable property) The undersigned being the Authorised Officer of Bank of India, Chandkheda Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 04.06.2022 calling upon the Borrower Shri Rakeshkumar Vasantbhai Vora, Mrs. Manjulben Vasantbhai Vora & Guarantor Shri Vasantbhai Aljibhai Vora to repay the amount mentioned in the notices being in Home loan Rs. 25,40,218.56 + interest amount since Account turns NPA within 60 days from the date of receipt of the said notice.

The borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given t the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interes: Enforcement Rules 2002 on this the 30th day of August of the year 2022.

The borrower / Guarantor in particular and the public in general is hereby cautions not to deal with the property described herein below and any dealings with the property will be subject to the charge of the Bank of India, Chandkheda Branch for an amount of Home Ioan Rs. 25,40,218.56/- (Twenty Five Lakh Forty Thousand Two Hundred Eighteen Rupees and Paisa Fifty Six) and interest thereon

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

#### **DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

Mortgage property over the residential property Row House/Tenament No. A/32, Plot Area 110 Sq. Yards i.e. 91.97 Sq. Mtrs. and construction admeasuring 58.5 Sq. Mtr in the scheme known as ASHWAMEGH OF ASHWAMEGH (Chandkheda) C.H.S.L situated on the land bearing Revenue Survey No. 298, T.P.S. No. 69, (chandkheda Zundal-Traged) situated at mouie-Chandkeda Taluka Sabarmati, Dist. Ahmedabad and sub dist. Ahmedabad-2(Vadaj) The said Property Boundries are as follows: North: Tenament No. A/37, South: 25 fit road for society, East: Tenament No. A/31 West: Tenament No. A/33.

Date: 30.08.2022, Place: Ahmedabad Authorised Officer, Bank of India

वैक ऑफ़ इंडिया Bank of India BOI

**CHANDKHEDA BRANCH** SHOP NO. 40-44. NAKSHTRA COMPLEX, IOC ROAD, CHANDKHEDA Ahmedabad - 380006, PHONE: 079 - 27630118/27630119

POSSESSION NOTICE [See Rule 8(1)]

Whereas **(For immovable property)**The undersigned being the Authorised Officer of Bank of India, Chandkheda Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 21.04.2022 calling upon the Borrower Shri Mukeshkumar Gokalbhai Prajapati & Mrs. Sulochanaben Mukeshbhai Prajapati to repay the amount ned in the notices being in Home Ioan Rs. 24,25,385/- +interest amoun since Account turns NPA and Personal Ioan Rs. 1.52.669/- interest amoun since Account turns NPA within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section the 13 of Act read with rule 8 of the Security Interes: Enforcement Rules 2002 on this the 30th day of August of the year 2022.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property described herein below and any dealings with the property will be subject to the charge of the Bank of India, Chandkheda Branch for an amount total of Home loan and Personal loan Rs. 25.78.054/- (Twenty Five Lacs Seventy Eight Thousand Fifty Four Rupees ) and interest thereon.

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

### **DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

Flat No. 502, on the fifth Floor, in I Block admeasuring 50.22 Sq.Mtrs. Balcony area admeasuring 2.35 sq. mtrs and wash area admeasuring 2.35 sq. mtrs in the scheme Known as Asshray-9 and undivided proportionate share alongwith comon amenities constructed on the land bearing Survey Block No. 61 Hec-Are-Sq. Mtrs. 26-16-56 of T.P. Scheme No. 66/A & F.P. No. 76/2 paiki & sub plot no. 2 land area admeasuring 40859.53 Sq. Mts. paiki NA land area admesuring 20743 sq.mtrs situated and lying at Mouje/Village:Kali, Taluka : Sabarmati, Dist. Ahmedabad-2 (Vadaj) The said property Boundaries are as follows : East: Block P-1, West : Flat No. 01-503, North lat No. 0-501, South : Flat No. 0-503.

Authorised Officer, Bank of India Date: 30.08.2022, Place: Ahmedabad

क ऑफ़ इंडिया Bank of India BOI

from the date of receipt of the said notice.

BANK OF INDIA - SABARMATI BRANCH RAMNAGAR, AHMEDABAD-380005 PHONE:-079-27500931/27500241

#### Email: Sabarmati.Ahmedabad@bankofindia.co.in POSSESSION NOTICE [See Rule 8(1)]

Whereas, **(For immovable property)** The undersigned being the authorized officer of the Bank of India, Sabarmati Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 03-09-2021 calling upon the borrower Mrs. Shardahen Saviibhai Ramani (Guarantor-Mortgagor A/c M/s. Nyalkaran Industries Proprietor Mr. Kirit Bhai Ramani) to repay the amount mentioned in the notice being in Cash Credit Limit Rs. 60,34,584.08 + Interest amount since Account turns NPA within 60 days

The borrower having failed to repay the amount, notice is hereby given to the Guarantor and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 02st day of September of the year

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property described herein below and any dealings with the property will be subject to the charge of the Bank of India Sabarmati Branch for an amount of Cash Credit Limit Rs.60,34,584.08 (Sixty lac Thirty Four Thousand Five Hundred

Eighty Four rupees & Paisa Eight) and interest thereon. The borrowed/Guarantor attention is invited to provisions of sub-section (8) of

#### section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. **DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

Mortgage of Residential Bungalow no. 3. Amantran Bungalows, Onn. Gangotr Bungalows, Near Dipak School, New Nikol, Ahmedabad – 382350 situate at R.S.No. 292/2/1, FP No. 100/2, Draft TPS no. 103, Mouje Sim Nikol, Tal. City, Sub District Ahmedabad (Odhav) District Ahmedabad bounded by: East: 7.50Mts. Society Road, West: Society Boundary, North: House No.04, South: House No.02

Date: 02-09-2022 Authorised Officer, Bank of India Place: Ahmedabad

MANGALAM SEEDS LIMITED

Regd Off.: 202, Sampada Complex, B/h. Tulsi Complex, Mithakhali Six MANGALAM Roads, Navrangpura, Ahmedabad-9. CIN: L01112GJ2011PLC067128

NOTICE OF 11th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION & BOOK CLOSURE

Notice is hereby given that: The 11th Annual General Meeting of the members of Mangalam Seeds Limited will
be held at the Registered Office of the Company at 202, Sampada Complex, B/h. Tuls Complex, Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad, Gujarat, India-380 009 on Thursday. September 29. 2022 at 11:00 A.M. to transact the business as set forth

in the AGM Notice dated September 03, 2022. Electronic copies of the Notice of AGM and Annual Report for the Financial year 2021 22 have been sent to all the members whose E-mail IDs are registered with the Company / Depository Participant(s). The Company has dispatched the Notice alongwith the Annual Report on September 03, 2022. The same are also available or the website of the Company at www.mangalamseeds.com. The AGM Notice along with the Explanatory Statement under Section 102 of the Companies Act. 2013 (the "Act") Proxy Form and Attendance Slip have been sent through permitted mode to all the

Members, whose names appeared in the Register of Members as on August 26, 2022. 3. Members holding shares either in physical form or dematerialized form, as on the cutoff date i.e. September 20, 2022, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of Kfir Technologies Limited ("KFin Tech") from a place other than venue of AGM ("remote

e-voting"). All the members are informed that: . The business as set forth in the Notice of AGM may be transacted through voting by

electronic means:

b. The remote e-voting shall commence on September 26, 2022 (09:00 A.M. IST); c. The remote e-voting shall end on September 28, 2022 (05:00 P.M. IST):

d. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is September 20, 2022: e. E-voting by electronic mode shall not be allowed beyond 05:00 P.M. IST or

September 28, 2022;

. Any person, who acquires shares of the Company & becomes member of the Compan after dispatch of the Notice of the AGM and holding shares as of the cutoff date i.e. September 20, 2022 may obtain the login ID and password in the manner as detailed in the Notice, which amongst others also prescribe that Members may call KFinTech's tol free number 1800-345-4001 or send an e-mail request to evoting@kfintech.com. . In case of any queries on e-voting, Members may refer Help and FAQs on e-voting and

User Manual for Shareholders available at the download section o https://evoting.kfintech.com or contact Mr. Vasanth Rao, Manager, KFin Technologie Limited at Selenium Building, Tower-B. Plot No 31 & 32, Financial District Nanakramguda, Serilingampally, Hyderabad, Rangareddi, Telangana, India-500032 E-mail ID: vasanth.g@kfintech.com or contact on KFin Tech's toll free number. . The Company shall also provide facility for voting through physical ballot paper at the

AGM and Members attending the AGM who have not already casted their votes by remote e-voting shall be able to exercise their right to vote at the AGM. The Members who have casted their votes by remote e-voting may also attend the AGM but shall no be entitled to cast their vote again. The Notice of AGM is available on the Company's website www.mangalamseeds.com

 The Register of Members and the Share Transfer books of the Company will remain closed from Thursday, September 22, 2022 to Thursday, September 29, 2022 for annual closing By order of the Board of Directors

Date: 05.09.2022

For Mangalam Seeds Limited Sd/- Pravinbhai Mafatbhai Patel Managing Director (DIN: 03173769)

RIDDHI CORPORATE SERVICES LIMITED

Regd. Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, medabad GJ-380009 Contact No.: 079-26580767, Email: investor@rcspl.n Website: www.riddhicorporate.co.in CIN: L74140GJ2010PLC062548

NOTICE TO THE MEMBERS OF THE COMPANY REGARDING 12TH ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VC / OAVM.

Notice is hereby given that the 12th Annual General Meeting (12th AGM) of the Members of Riddhi Corporate Services Limited will be held on **Thursday, 29th** September, 2022 at 01:00 p.m. through Video Conferencing (VC)/ Other Audic Visual Means (OAVM) in compliance with the applicable provisions of the Companies Act. 2013 ('Act') & Rules framed there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021 respectively, issued by the Ministr of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIF P/2020/79 dated May 12, 2020 followed by Circular No. SEBI/HO/CFD/CMD2/CIR 2021/11 dated January 15, 2021 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular') to transact the business as set forth in the AGM Notice vithout the physical présence of the Members at a common venue

The Notice of 12th AGM and the Annual Report for the Financial Year 2021-22 ("Annual Report for the Financial Year 2021-22) Report") will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depositary Participants "Depositary"), in accordance with the MCA Circular/s and the SEBI Circular. Members who have not registered their e-mail address with the Depositories Company / Registrar and Share Transfer Agent ('RTA'), so far is requested to register/update their e-mail addresses in the following manner:

Members whose email addresses are already registered with the Company Depositories, may follow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members whose email addresses are not egistered with the Company / Depository may follow the below process for

egistering or updating their email addresses. Members holding shares in electronic/ Demat form, please update your emai address with your Depository Participants. However, Members may temporarily register the same with the Company's Registrar & Share Transfer Agent i.e. M. . Purva Sharegistry (India) Pvt. Ltd. at https://www.purvashare.com/email-and hone-updation/ on their website www.purvashare.com/ in the Register you Email id tab by providing details such as Name, DP ID, Client ID, PAN, mobile

Members holding shares in physical form and who have not registered their email address may register the same with the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Purva Sharegistry (India) Pvt. Ltd. at https://www.purvashare.com/email-and-phone-updation/ on their website www.purvashare.com/ in the Register your Email id tab by providing details such as Name, DP ID, Client ID, PAN, mobile number and e-mail address. The 12th AGM Notice will be sent to the shareholders holding shares as on cut

-mail addresses in due course. In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

off date for the dispatch, in accordance with the applicable laws, on their registered

Place: Ahmedabad

For, Riddhi Corporate Services Limited sd/- Alpit Pravinchandra Gor Whole Time Director - DIN: 03041615

#### **ATN INTERNATIONAL LIMITED**

CIN · I 65993WR1983PI C080793 Regd. Office: 10 Princep Street, 2nd Floor, Kolkata - 700072 Email: atninternationallimited@gmail.com, website: www.atninternational.in Phone: 91-33-4002 2880, Fax:91-33-2237 9053 NOTICE OF 38th ANNUAL GENERAL MEETING (AGM),

E-VOTING INFORMATION AND BOOK CLOSURE l . The 38th (Thirty-Eighth) Annual General Meeting (AGM) of Members of the Company will be held o vednesday, the 28th day of September, 2022 at 2:00 PM. (IST) through Video Conferencing ("VC") ther Audio Visual Means (OAVM"), in compliance with applicable provisions of Companies Act, 201 and rules made there under. SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 015, the Secretarial Standard an General Meetings (SS-2) issued by Institute of Companies retaries of India read 'with MCA's circular no. 02/2022 dated 5th May, 2022 and SEBI circular no.

SEB1/H0/CFD/CMD2/C1R/P/2022/62 dated 13th May, 2022. Members will be able to attend the meeting only through VC/OAVM and those member participating in the said AGM through VC/OAVM facility shall be reckoned for the purpose of quorun nder Section 103 of the Companies Act. 2013.

 In Compliance with MCA Circulars and SEBI Circular, the Notice of 38th AGM including details and instructions for remote e-voting/e-voting at AGM and Financial Statements including Auditors' Report, Board's Report and related Annexures attached therewith (Collectively referred to as "Annual Repor 2021-22" or "Annual Report") have been sent on 03.09.2022, in electronic mode, to all the member whose e-mail ids are registered with the Company's Registrar and Share Transfer Agents (RTA), M/s Maheshwari Datamatics Pyt Ltd /their respective Depositary Participant(s). This is also in accordanc Management & Administration) Rules, 2014 and Rule 11 of the Companies (Accounts) Rules 2014.The same are also available on the website of the company at www.atninternational.in and car siso be accessed from the website of Bombay Stock Exchange at www.besindia.com, National Stoc Exchange at www.nseindia.com and that of Calcutta Stock Exchange at www.cse-india.com

. The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Thursday, 22nd day of September, 2022 to Wednesday, 28th day September, 2022 (Both day) Inclusive) for the purpose of Annual General Meeting. All members holding shares either in physica orm or dematerialized form, as on the cut-off date. Wednesday, 21st September, 2022 are provide with the facility to cast their vote electronically (e-voting) on the business as set forth in the Notice of the 38th AGM, for which the company has engaged the services of Central Depository Services (India td as E-Voting agency. Members may cast their votes remotely (Remote-E-voting) or cast votes at the AGM (E-voting), using electronic system provided by CDSL. The facility to cast vote electronically a the AGM (E-voting) will be made available for members attending the AGM who have not cast their nte(s) by remote F-Voting

All the members are informed that

. The remote e-voting shall commence on Sunday, 25th September, 2022 at 9:00.A.M. (IST)

o. The remote e-voting shall end on Tuesday, 27th September, 2022at 05:00 PM(IST). c. Remote E-voting will not be allowed beyond the aforesaid date and time and the Remote E-votir nodule shall be forthwith disabled by CDSL, upon expiry of the aforesaid period.

5. The cut-off date for determining the eligibility to vote by electronic means and to attend the AGM i Wednesday, 21st September, 2022. Members who have cast vote(s) through Remote E-voting ma attend the meeting but will not be entitled to cast their vote(s) at the AGM

Members may note that: Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change

b) The Company has appointed Mr. Atul Kumar Labh, Practicing Company Secretary as the Scrutinize to scrutinize the voting process in a fair and transparent manner.

ix. In case of any queries, you may refer the Frequently asked Question (FAQs) for Shareholders and evoting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call on toll free no. 1800225533. Members may also write to the Company Secretary at the Company's email address tninternationallimited@gmail.com

Place: Kolkata Date: 03.09.2022

For ATN International Limite Sd/- Amitava Das, Company Secretary



**INNOVATIVE TYRES & TUBES LIMITED** CIN: L25112GJ1995PLC086579

Registered Office: 1201, 1202, 1203 - GIDC Halol -389350, Panchmahals, Gujarat Tel.: (02676) 220621 Email: investors@innovativetyres.co.in; Website: www.innovativetyres.com

NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING

AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 27th Annual General Meeting (AGM\*) of the Members of Innovative Tyres & Tubes Limited will be held on Wednesday, September 28, 2022 at 10:00 A.M. (IST) through Video Conferencing ("VC") Other Audio-Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM.

Notice of AGM.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with Ministry of Corporate Affairs ("MCA") General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2021 dated January 13, 2021 and other applicable circulars issued by the MCA and SEBI Circular dated May 12, 2020 Circular dated January 15, 2021 and Circular dated May 13, 2022 (collectively referred to as 'relevant circulars'), the Notice of the AGM and Annual Report including the Audited Financial Statements for the financial year 2021-22 have been sent in electronic mode to Members whose email IDs registered with the Company's Website at Depository Participants.

Depository Participants.

The copy of the Annual Report and AGM notice is also available on the Company's Website at www.innovalivetyres.com, websites of the stock exchange i. e. National Stock Exchange of India Limited-Emerge Platform at www.nseindia.com and website of Link Intime India Private Limited ("LIIPL") at https://www.inkintime.co.in. The dispatch of Notice of the AGM through e-mails has been completed

E-VOTING

Members are provided with a facility to attend the AGM through electronic platform provided by Company's Registrar and Share Transfer Agent viz. LIIPL. Members are requested to visit https://instameet.linkintime.co.in and access the shareholders/imembers login by using the remote e-voting credentials provided to them. The documents pertaining to the items of business to be transacted in the AGM shall be available for inspection at www.innovativetyres.com.

In the AGM shall be available for inspection at www.innovativetyres.com.

Instructions for Remote - Voting and - voting:

1. Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time, and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 the Members are provided with the facility to cast their votes on all the resolutions as set out in the Notice of AGM using electronic voting system ("Remote - Voting") provided by LIIPL. Member's holding shares either in physical form of modernaterialized form, as on Wednesday, September 21, 2022 ("Cut-off date") can cast their vote through remote e-voting of LIIPL. In https://instavote.linkintime.co.in. Aperson whose name is recorded in the register of Members or in the Register of Berneficial Owner maintained by the Depositories as on the Cut-off date only shall be entitled to avail the facility of Remote e-Voting.

2. The Remote e-Voting action will commence on Sunday. September 25, 2022 at 9.00 A.M. (IST) and Cut-orr date only shall be entired to avail the facility of Remote e-Voling.

2. The Remote e-Voling period will commence on Sunday, September 25, 2022 at 9.00 A.M. (IST) and ends on Tuesday, September 27, 2022 at 5.00 P.M. (IST). The Remote e-Voling module shall be disabled by LIIPL thereafter. Once the vote on a resolution is cast by the member, the member cannot profif by the property.

modify it subsequency.

3. Members who have acquired shares after the sending of the Annual Report through electronic means and before the Cut-off date may obtain the USER ID and password by sending a request at enotices@inkintime.co.in or investors@innovaltve/pres.co.in. However, if a person is already registered with LIIPL for remote e-voting then he/she may use the existing USER ID and Password and

registered with LIIPL for remote e-voting then nevarie may use the coasted their vote by Remote cast the vote.

4. Members attending the AGM through VC/OAVM but who have not casted their vote by Remote e-Voting shall be eligible to cast their vote through e-Voting during the AGM (when window for e-voting is activated upon instructions of the Chairman). Members who have voted through Remote e-Voting shall be eligible to attend the AGM through VC/OAVM, however they shall not be eligible to vote at the meeting. Further the Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

The procedure of e-voting is provided in the Notice of the AGM as well as in the E-mail sent to the

reckoning the quorum under Section 103 of the Act.

5. The procedure of e-voting is provided in the Notice of the AGM as well as in the E-mail sent to the members by LIIPL. Please refer the e-voting user manual for members available in the downloads section of the e-voting websites of LIIPL i.e. https://instavote.linkintime.co.in. In case the shareholders have any queries or issues regarding e-voting, please refer the Frequently Asked Questions ("FAQs") and INSTAVOTE E-voting Manual available at https://instavote.linkintime.co.in under help section or write an e-mail to enotices@linkintime.co.in or call at Tel: 022-4918 6000. Further, the Shareholders are also requested to refer to the Notice of the AGM for more details on process to be followed from their side, if any, in this regard.

**BOOK CLOSURE** 

BOOK CLOSURE

NOTICE is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act 2013 read with Companies (Management and Administration) Rules 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, September 22, 2022 to Wednesday September 28, 2022 (both days inclusive) for the purpose of AGM. For Innovative Tyres & Tubes Limited

Date: September 03,2022 Place: Vadodara Arvind Tambi
Company Secretary and Compliance Officer



O. A. 573/2022 OUTWARD NO. 1935/2022

**NOTICE THROUGH PAPER PUBLICATION** CANARA BANK

Versus M/S ANANDEE ENTERPRISES & ANR

(1) M/s ANANDEE ENTERPRISE ldress: Plot No. 68, GIDC, Sector 10A, Gandhidham - 370 201, (2) Mr. Deviprasad Ghanshyam Pandey

Address: Plot No. 134, Survey No. 474, Bageshree Township, Village: Varsamedi, Anjar WHEREAS the above named Applicant has filed the above referred application in this

Tribunal. WHEREAS the service of Summons/Notice could not be effected in the ordinary manner and whereas the application for substituted service has been allowed by this

Defendant are hereby directed to show cause as to why the original Application should not be allowed

You are directed to appear before this Tribunal in person or through an Advocate on 13.10.2022 at 10.30 a.m. and file the written statement/Reply with a copy thereof furnished to the applicant upon receipt of the notice.

Take notice that in case of default, the Application shall be heard and decided in vour absence

GIVEN UNDER MY HAND AND SEAL OF THE TRIBUNAL ON THIS 25" AUGUST, 2022. PREPARED BY Sd/

**CHECKED BY** 

क ऑफ़ इंडिया Bank of India **BO**I

BANK OF INDIA - SABARMATI BRANCH RAMNAGAR AHMEDARAD - 38000F

PHONE:-079-27500931/27500241

Email: Sabarmati.Ahmedabad@bankofindia.co.in POSSESSION NOTICE [See Rule 8(1)]

(For immovable property) The undersigned being the authorized officer of the Bank of India, Sabarmati Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a deman notice dated 01-06-2022 calling upon the borrower Mr. Rafiqbhai Ibrahimbhai Ghanchi & Mrs. Sabana Munnabhai Shaikh to repay the amount mentioned in the notice being in Home loan Rs. 21,35,410.92 + Interest amount since Account turns NPA within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 1st day of September the year 2022. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property described herein below and any dealings with the property will be subject to the charge of the Bank of India Sabarmati Branch for an amount of Home loan Rs. 21,35,410.92 (Twenty One lac Thirty Five Thousand Four Hundred Ten rupees and paisa Ninety Two) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

#### **DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

Mortgage Residential Property situated at B-305, third floor, Ekta Avenue, Old RS no. 102/A and 102/B, TP scheme no. 16, Plot No.143 paiki, City survey no. 3093 to 3166 paiki City survey no. 3138 to 3142 Mouje: Shaher Kotda, Tal. City District Ahmedabad in the name of Rafiqbhai I Ghanchi which is bounded as under: East: Main Gate, Common passage, stairs & Lift, West: Open space of Ekta Avenue, North: Common wall with Block B Flat no. 306, South: Common wall with Block B Flat no. Sd/ Date: 01-09-2022

Place : Ahmedabad

**Authorised Officer** Bank of India

#### PUBLIC NOTICE

That Pankai Mancharlal Aggarwal is the owner of property bearing Plot No. B/2-11 i "The Sachin Udhyognagar Sahakari Mandali Limited". Constructed on land bearing Revenue Survey No. 156/2, 136/2, 137, 138, Block No. 163 & 141, Situated at Moje Village: Vanz, Sub-District: Choryasi, District: Surat. The present owner has admit the [1] Original Registration Receipt of Sale deed which was registered at Serial No. 32 ated 04/01/2017 [Order Date15/06/2017] [Its Old Registration No. 18317, dated 27/07/2008] in favour of [1] Beladevi Rameshkumar Agrawal, [2] Sangitadev Sureshkumar Agrawal and [3] Babitadevi Manojkumar Agrawal & [2] Original Allotmen Letter issued by Sachin Udhyognagar Sahkari Mandli Ltd in favour of [1] Harila Nanabhai Dapkawala, [2] Arvindkumar Nanabhai Dapkawala and [3] Rameshchandra Nanabhai Dapkawala were misplaced and are not traceable and it were never ever the had used as security for any financial Assistance by them or anyone else any person et and the present owner is also admit that he is holding physical possession of the said Property. If any one having any right of ownership or claim of whatsoever nature i respect of the said Original Documents are hereby informed to raise any of such right or claim, within a period of "Seven" days from the date of this notice personally before me along with documentary proofs, after that no rights or claim shall be entertained.

SIDDHARTH A. PATOLAWALA - Advocate 9/1591-92, Nani Hing Pole, Old Saibaba Temple Street, Chauta Bazar Surat - 395 003. Mob. No.: 63553 99412 & 98254 46463.



3rd Floor Bhikhubhai Chamber

Ellishbridge, AHMEDABAD-380006

NOTICE THROUGH PAPER PUBLICATION

(1) Mr. Mehul Upendrabhai Pathak Address: Flat No. 204, Rudraksh Shops and Flat Behind Dhaval

Address: Flat No. 204, Rudraksh Shops and Flat Behind Dhaval Purshing Homes, Nr. Sangam, Crossing, Harni Varasai Road, Vadodara.

(3) Upendra Chandulal Pathak Address: Flat No. 204, Rudraksh Shops and Flat Behind Dhaval Purshing Homes, Nr. Sangam, Crossing, Harni Varasai Road, Vadodara.

(1) WHEREAS the service of Summons/Notice could not be effected in the ordinary manner and whereas the application for substituted service

(2) Defendant are hereby directed to show cause as to why the Origina Application Should not be allowed.

(3) You are directed to appear before this Tribunal in person or through an Advocate on 19.10.2022 at 10.30 am and file Written Statemen

GIVEN UNDER MY HAND AND SEAL OF THE TRIBUNAL ON THIS 1<sup>ST</sup> of September, 2022

Checked By

REGISTRAR DEMAND

#### 店 H D I C Housing Development Finance Corporation Ltd.

Branch: 201-204, Riddhi Shoppers, Opp imperial Square, Adajan-Hazira Road, Surat-395009

Under Section 13 (2) of the Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 (Act) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002. Whereas the undersigned being the Authorised Officer of Housing Development Finance Corporation Ltd. (HDFC Limited) under Securitisation And Reconstruction Of Financial Assets And forcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section (2) of the said Act, calling upon the Borrower(s) / Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notice/s, within 60 days from the date of the spective Notices, as per details given below. The undersigned have, caused these Notices to be pasted on the premises of the last Known respective addresses of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s), Copies of the said Notices are available with the undersigned, and the said Borrower(s) / Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the detailed and a sequential devalution prompts.

ersigned on any working day during normal office hours In connection with the above, Notice is hereby given, once again, to the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) to pay to HDFC Limited, within 60 days from the date of publication. is Notice, the amounts indicated hereinbelow in their respective names, together with further interest @ 18% p.a. as detailed in the said Demand Notices from the respective dates mentioned below in column to the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following ecured Asset(s) have been mortgaged to HDFC Limited by the said Borrower (s) respectively.

Borrower(s)/Legal Heir(s)/Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secure-

Во	rrower(s)/LegalHeir(s)/LegalRepresentative(s)attention is/are invited to the p	rovisions of sub-section (8) of	section 13 of the A	ct, in respect of time available to redeem the secured asset/s.
Sr. No.	Name of Borrower(s)/ Guarantor(s)/Legal Heir(s) / Legal Representative(s)	Total Outstanding Dues	Date of Demand Notice	Description of Secured Asset(s)/ Immovable Property (ies)
(a)	(b)	(c)	(d)	(e)
1	MR. VISHNUBHAI DWARKAADAS PATEL (Borrower) MR. AKASH PATEL (CO-BORROWER) MRS. ASHABEN VISHNUBHAI PATEL (Co-Borrower) 140567-646113329	Rs. 30,46,051/- as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	ROW HOUSE-273, SWAPNA VILLA, B/H DADA BHAGWAN TEMPLE, B/S AMBER PALACE, NANSAD NAHER, KAMREJ, SURAT-394305.
2	MR. DAYASHANKAR RAMCHIJ TIWARI (Borrower) 145061 - 614222574	Rs. 7,91,083/- as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	FLAT-01, GROUND FLOOR, SAHYOG RESIDENCY, PLOT-53, 54, 55, S. NO. 112/PAIKEE-1/PAIKEE-53, HARIDHAM, NR. SARASWATI HINDI HIGH SCHOOL, GANDHIWADI, VALSAD-396165.
3	MR. SHAUKATHUSAIN SHARAFATHUSAIN ANSARI (Borrower) MRS. MUMTAZARA ANSARI (Co-Borrower) 145555-634733827	Rs. 44,52,044/- as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	BUNGLOW-22-AS-PER-PLAN-46-47, DEEWAN-E- KHAAS, S. NO. 145/A, BLOCK-145/A, NR. SPARKLE, CHOKHAD, MAROLI-VESMA ROAD, DABHEL, NAVSARI-396415.
4	MR. MAHESH KUMAR (Borrower) MRS. SHALUBEN RAMSAJIVAN KORI (Co-Borrower) 140576-630145893, 631438442 & 630910853	Rs. 13,66,969/-, Rs. 49,163/- And Rs. 43,348/- Respectively as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	ROW HOUSE-294, RAHI TOWNSHIP VIBHAG-1, S. NO. 352, 353, 354, BLOCK-369, NEXT TO GANGADHARA BUS STOP, NR. GANGADHARA VILLAGE, NR. MOTAGAM, KARELI, PALSANA, SURAT-394315.
5	MR. CHELLAPPA ERULLAAPPAN NAIDU (Borrower) MRS. CHENTA CHELLAPPA NAIDU (Co-Borrower) MR. AJAY KUMAR DUBEY (Guarantor) 145069-291061618	Rs. 2,05,141/- as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	172 & 173, JAY NARAYAN KUNJ SOCIETY, R. S. 7/P, 4/P, 7/1P, NR. PAKA KOT, CHHANI, VADODARA-391740.
6	MR. DHEERAJ PARASAR (Borrower) MRS. CHANDNI KUMARI (Co-Borrower)	Rs. 42,188/- And Rs. 17,73,434/- Respectively as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	FLAT-B6/10, 2ND FLOOR, YOGI DARSHAN (S. NO. 100/1), NEAR BASERA HSG. COMPLEX, VAPI-SILVASSA ROAD, VILL. AMLI, SILVASSA, DADRA & NAGAR HAVELI-396230.
7	140504-648407348 & 647371436  MR. ASHOK KUMAR M. (Borrower)  MRS. KNYAVATI (Co-Borrower)  143812-641662000 & 641037927	Rs. 20/- And Rs. 13,05,539/- Respectively as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	FLAT-507, 5TH FLOOR, PEARL AVENUE-A2, S. NO. 50/P2, NR. DADRA CHECK POST, SILVASSA ROAD, DUNGRA, VAPI-396191.
8	MR. HARDIK MODI (Borrower) MR. MANISHKUMAR MODI (Co-Borrower) MRS. NILAXIBEN MODI (Co-Borrower)  140803-634191410, 646857367, 646378968 & 635803129	Rs. 24,78,251/-, Rs. 59,028/-, Rs. 5,25,049/- And Rs. 3,43,393/- Respectively as on 31*t Jul., 2022*	29 Aug., 2022	FLAT-404, 4TH FLOOR, BHAKTI DHARAM TOWNSHIP SHREE SAHAJAN, S. NO. 113/1, BLOCK-35, B/H RAJHANS PLATINUM RESI., NR. STERLING HEIGHTS, PALANPUR CANAL ROAD, PALANPUR, SURAT-395009.
9	MR. NEELESH PATEL (Borrower) 143579-634932860	Rs. 32,71,370/- as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	FLAT-A/1001, 10TH FLOOR, ARIHANT HEIGHTS-A & B-WING, S. NO. 78/1, BLOCK-126, FP. NO39, TPS NO09, B/S. STUTI ICON, NR. SAI MILAN RESIDENCY, OPP. CORAL HEIGHTS, PALANPUR, SURAT-395009.
10	MR. CHINTAN KALUBHAI PIPALIYA (Borrower) MRS. RANJANBEN KALUBHAI PIPALIYA (Co-Borrower) 140574-654361701 & 653459900	Rs. 1,34,132/- And Rs. 32,25,116/- Respectively as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	ROW HOUSE-125, BAPA SITARAM NAGAR SOC., S. NO. 121, NR. SANSKRUT SOCIETY, NR. YAMUNA NAGAR, DABHOLI,SURAT-395004.
11	Wife/Son/Husband/Daughter of MR. PRAVEEN KUMAR JAIN [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR. PRAVEEN KUMAR JAIN [Since Deceased] (Borrower) MRS. NIRUBEN PRAVEEN KUMAR JAIN (Co-Borrower) 138353-654831530 & 659028610	Rs. 30,59,637/- And Rs. 1,03,581/- Respectively as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	UNIT-G-24-BLDG-A, GROUND FLOOR, SUMERRU BUSINESS CORNER, S. NO. 370, BLOCK-328, FP-119, TP-14, OPP. SOMCHINTAMANI APPT., B/H RAJHANS THEATER, PAL, SURAT-395009.
12	MR. HITESH BHUPATBHAI VAVADIYA (Borrower) MRS. ASHABEN HITESHBHAI VAVADIYA (Co-Borrower) 140564-627575652 & 612019798	Rs. 8,24,358/- And Rs. 12,21,553/- Respectively as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	FLAT-403, 4TH FLOOR, SRUSHTI RESIDENCY-2 C-TYPE, S. NO. 454/1, BLOCK-743, NR. SHRUSHTI ROW HOUSE, NR. HAPINESS RESIDENCY, AMROLI-SAYAN ROAD, SURAT-395003.
13	MR. AJOYBHAI PRABHATKUMAR BHATTACHARYA (Borrower) 144778-614427900	Rs. 12,24,950/- as on 31 <sup>st</sup> Jul., 2022*	29 Aug., 2022	UNIT-133,ROW HOUSE-133, LOTUS POND, BLOCK-640, M. D. ROAD, TOWARDS SATEM, OPP. KHADSUPA BOARDING SCHOOL, NEAR SAI BABA TEMPLE, ASHTGAM, NAVSARI-396424
14	MR. JAYDEEP PRAVINBHAI PANELIYA (Borrower) MR. PRAVINBHAI VAJUBHAI PANELIYA (Co-Borrower) MRS. BHANUBEN PRAVINBHAI PANELIYA (Co-Borrower)	Rs. 13,08,376/-, Rs. 16,949/-	29 Aug., 2022	ROW HOUSE-112, DHARA RESIDENCY-2, BLOCK-47/A, OPP. NANDINI-2, NR. DHARA RESI. & SARDAR VILLA, NR. TAPI MAIYA. VELANJA-SHEKHPUR ROAD.

145097-637830129, 639418879, 639418707 & 637830167 as on 31st Jul., 2022 with further interest @ 18% p.a. as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realization

If the said Borrowers shall fail to make payment to HDFC Limited as aforesaid, then HDFC Limited shall proceed against the above Secured Asset(s) / Immovable Property (ies) under Section 13 4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) as to the costs and consequences.

The said Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset (s) / Immovable Property (ies), whether by way of sale, lease or attention of the provision of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or lenalty as provided under the Act.

For Housing Development Finance Corporation Ltd

Rs. 16.949/-Rs. 39,849/- And Rs. 5,41,405/-

Respectively

Date: 03-09-2022 Place : Surat

MR. NARESHBHAI GORDHANBHAI DEVANI (Guarantor)

**Authorised Officer** Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020. Corporate Identity Number : CIN : L70100MH977PLC019916. E-mail : customer.service@hdfc.com, Website : www.hdfc.com

### **DEBTS RECOVERY TRIBUNAL - II** (Ministry of Finance, Government of India)

3rd Floor, Bhikhubhai Chamber, 18 - Gandhi Kunj Society Opp. Deepak Petrol Pump, Ellisbridge, AHMEDABAD - 380006

...APPLICANT

...DEFENDANT

REGISTRAR



.....DEFENDANTS

**DEBTS RECOVERY TRIBUNAL - II** (Ministry of Finance Government of India)

18, Gandhi Kunj Society, Opp. Deepak Petrol Pump,

Exb. No. 07

**PUNJAB NATIONAL BANK** APPLICAN1

MR. MEHUL UPENDRABHI PATHAK & ORS

Purshing Homes, Nr. Sangam, Crossing, Harni Varasai Road, Vadodara. (2) Mr. Himanshu Mehul Pathak

WHEREAS the above named applicant has filed the above referred application in this Tribunal.

has been allowed by this Tribunal.

Reply with a copy thereof furnished to the applicant upon receipt of the notice (4) Take notice that in case of default, the Application shall be heard and

decided in your absence.

Prepared By



NOTICE